

મહે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્ટકલાસ સાહેબશ્રીની અદાલતમાં, ખાંભા, જિ.અમરેલી

આંક- ૭

ફરીયાદી:- શ્રી સરકાર

વિ.

આરોપી:- રામભાઈ સામતભાઈ કણસાગરા
રહે. ગીદરડી તા. ખાંભા જિ. અમરેલી

ગુનો:- ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ-૬૬(૧)ની મુજબ

-: ઠરાવ:-

- (૧) આજરોજ નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના ઉપક્રમે નેશનલ લોક અદાલત યોજવામાં આવેલ છે તે મુજબ સદર કેસ આજરોજ સ્પે. સિટીંગમાં રાખવામાં આવેલ છે.
- (૨) આરોપી કોર્ટ રૂબરૂ વકીલશ્રી સાથે હાજર થયેલ છે અને પોલીસ પેપર્સની નકલો વિના મુલ્યે આપ્યાની ખાતરી કરી આરોપી વિરુદ્ધ પ્લી રેકર્ડ કરતા આરોપીએ સ્વૈચ્છાએ ગુનો કબુલ કરવા માંગતા હોવાની હકીકત જણાવેલ છે.
- (૩) આરોપીએ ગુના કબુલાત પુરસીસ આપી જાહેર કરેલ છે કે, અમો સામાન્ય અને ગરીબ વર્ગના છીએ, અમારે કોઈ સ્થિર ઘંઘો નથી, અમો છુટક મજુરી કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ, અમોને મજુરી કામ દરરોજ મળતુ નથી, અમો અમારા કુટુંબમાં એક જ કમાનાર સભ્ય છીએ, અમારા બાળ-બચ્ચા તથા અમારા કુટુંબના ભરણપોષણની જવાબદારી અમારા ઉપર રહેલી છે, અમો ભવિષ્યમાં આવો કોઈ ગુનો કરીશું નહી તેવી ખાત્રી આપીએ છીએ જેથી અમારી સામાજીક તથા આર્થિક પરિસ્થિતીને ધ્યાનમાં રાખી અમારી ઉપર રહેમ રાહ રાખવા અરજ ગુજારેલ છે.
- (૪) ફરીયાદપક્ષના કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી વગર પાસ પરમીટના દાડનો નશો કરી જાહેર સ્થળ ઉપરથી લથડીયા ખાતા પકડાયેલ છે. જેથી આરોપી વિરુદ્ધ ગુજરાત રાજ્ય નશાબંધી અધિનીયમની કલમ ૬૬(૧)ની મુજબના ગુનાનું તહોમત મુકવામાં આવેલ છે.
- (૫) આરોપી વિરુદ્ધ ગુનાનો આક્ષેપ જોતા તથા આરોપી ધ્વારા કરેલ ગુના કબુલાત ધ્યાને લેતા તેમજ આરોપી આર્થિક તથા સામાજીક રીતે ગરીબ વર્ગના જણાય આવે છે તેમજ ભવિષ્યમાં બીજો કોઈ ગુનો નહી કરવાની ખાત્રી આપે છે. આરોપીએ જાહેર કરેલો પસ્તાવો તથા આરોપીની વર્તણુક તથા સામાજીક જવાબદારી ધ્યાને લેતા આરોપી ઉપર રહેમ રાહ રાખીને ઓછી સજા અને દંડ કરવામાં આવે તો આરોપી સમાજમાં ફરી વખત માનભેર જીવન શરૂ કરી અને સમાજ તથા દેશને ઉપયોગી થઈ શકે તેમ છે તે સંજોગોમાં ઓછી સજા તથા દંડ કરવો તે ન્યાયી અને ઉચીત માનું છું.
- (૬) નામ. માનવંત ગુજરાત હાઈકોર્ટ ધ્વારા **STATE OF GUJARAT Vs. NATWAR HARCHANDJI THAKOR, 2005 (1) GLR 709** નાં ચુકાદામાં એવું પ્રસ્થાપિત કરેલ છે કે, The word "special" has to be understood in contradiction to word "general" or "ordinary". It becomes apparent and unquestionable from the language employed in the proviso that the reasons to be recorded in writing in judgment for less than the minimum sentence, on the ground of presence of special and adequate reasons in the light of sentencing process must be special and adequate to the circumstances in a given case and peculiar to the accused in each

case. It is, therefore, very clear that the discretionary jurisdiction empowered in the trial Magistrates must be based on and in presence of special and adequate reasons to the contrary to be mentioned in the judgment of the Court for each case and each accused. (Para 42; See also Paras 35, 43 and 44) જે પ્રસ્થાપિત સિદ્ધાંતને હાલનાં કેસની હકીકત સાથે લક્ષમાં લેવામાં આવે તો, જો પુરતા અને વ્યાજબી કારણો હોય તો દરેક કેસની હકીકતને ધ્યાનમાં લઈ નીચેની અદાલતને કાયદામાં કરેલ લઘુતમ સજાની જોગવાઈ હોવા છતાં પણ ઓછામાં ઓછી સજા અને દંડ કરવાની સત્તા છે. ઉપરોક્ત ચુકાદો આરોપીના કેસને તથા સંજોગોને અનુરૂપ થતો હોય તેમ જણાય આવે છે.

- (૭) સદર કેસનું રેકર્ડ તથા ફરીયાદ પેપર્સ ધ્યાને લેતા તેમજ આરોપીની આર્થિક સ્થિતિ તથા સદર ગુના અંગે દયાની માંગણી જોતા, આરોપીને સજા કરતી વખતે ઉદાર વલણ રાખી સુધારવાની તક આપવાથી ન્યાયનો હેતુ જળવાય તેમ જણાતું હોય નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: આ ખરી હુકમ ::-

આ કામના આરોપીને બી.એન.એસ.એસ.ની કલમ- ૨૭૫ મુજબ ઉપરોક્ત ગુનામાં તકસીરવાન ઠરાવી, આરોપીને રૂા. ૧૦૦/- (અંકે રૂપિયા એકસો પુરા) નો દંડ કરવામાં આવે છે અને કોર્ટ ઉઠતા સુધીની સજાનો હુકમ કરવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો આરોપીને દિન- ૧૦ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.

સદર હુકમ આજ રોજ તા. ૧૪/૦૩/૨૦૨૬ ના રોજ સ્પે. સિટીંગમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

તારીખ- ૧૪/૦૩/૨૦૨૬
ખાંભા- સ્પે.સિટીંગ

(એમ.એ. મલેક)
જયુડી.મેજી.ફ.ક., ખાંભા
જી.જે.૦૧૪૩૫